Suzlon Energy Ltd.

One Earth, Hadapsar, Pune - 411 028, India



Phone : +91.20.61356135 / 67022000 Fax : +91.20.67022100 / 67022200

E-mail: pune@suzlon.com URL: www.suzlon.com

14th April 2023.

National Stock Exchange of India Limited, "Exchange Plaza",
Bandra-Kurla Complex, Bandra (East),
Mumbai-400051.

BSE Limited P.J. Towers, Dalal Street, Mumbai-400001.

Dear Sirs,

Sub.: Advertisement for despatch of First Reminder-Cum-Forfeiture Notice to the holders of partly paid-up equity shares, on which call money is to be paid, of Suzlon Energy Limited (the 'Company').

Ref.: Regulation 30 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Further to our intimation dated 13th April 2023 informing about intimation of despatch of Reminder-cum-Forfeiture Notice to the holders of such partly paid-up equity shares on which the First and Final Call Money remains unpaid, please note that the Company has issued following advertisement in all the editions of English national daily newspaper, "Financial Express", all the editions of Hindi national daily newspaper, "Jansatta", and Ahmedabad edition of Gujarati newspaper, "Jai Hind":

• First Reminder-cum-Forfeiture Notice to the holders of partly paid-up equity shares on which call money is to be paid (ISIN: IN9040H01011) of the Company published on 14th April 2023.

We hereby submit the Advertisement in 'pdf' format.

This is for your information as also for the information of your members and the public at large.

Thanking you,

Yours faithfully, For Suzlon Energy Limited

Geetanjali S.Vaidya, Company Secretary.

Encl.: As above.

FINANCIAL EXPRESS

HC upholds

via apps

PRESS TRUST OF INDIA

THE DELHI HIGH Court has

upheld the Centre's decision to

levy GST on the services

offered by auto-rickshaws or

other non-air-conditioned car-

riages through electronic com-

A bench headed by Justice

Manmohan dismissed the

petitions of Uber India Sys-

tems and others challenging

the 2021 Central government

notifications making fares in

respect of a booking through the platform of an electronic

commerce operator (ECO) for

an auto-rickshaw or bus ride

class which is "distinct" from

an individual service provider

and the notifications, which

take away an earlier exemption

from tax levy, are in compli-

ance with the object of the GST

law to levy tax on every trans-

action of supply of goods and

Ashok Leyland

launches portal

for used CVs

The court said ECOs form a

eligible for tax.

services.

merce operators like Uber.

New Delhi, April 13

GST on autos,

buses booked

BOARD APPROVES ISSUANCE OF NCDs

Vedanta gets nod to raise ₹2,100 cr

Parent firm seeking to shore up funds to trim debt

FE BUREAU Mumbai, April 13

MINING MAJOR VEDANTA, a subsidiary of London-headquartered Vedanta Resources (VRL), has approved raising of up to ₹2,100 crore through issuance of non-convertible debentures (NCDs) through private placements.

The NCDs would be raised in one or more tranches, the company said in a stock exchange update.

The move comes at a time when its parent VRL is seeking to shore up funds to trim debt. Earlier in March, Vedanta had approved its fifth interim dividend of ₹20.50 per share or a total of ₹7,621 crore for



■ Issuance of NCDs will be through private placements

■ The NCDs would be raised in one or more tranches, the firm said in a stock exchange update

FY23. With this, the total outgo by way of dividends for FY23 was at about ₹37,733 crore.

On March 29, Crisil Ratings

revised the outlook of Vedanta's NCDs and long-term bank facilities to 'negative' from 'stable', citing higher financial leverage and lower financial flexibility. Crisil had revised the rating of ₹6,444 crore and ₹3,000 crore NCDs to 'negative', while it reaffirmed an 'AA' rating. It reaffirmed an 'A1+' rating for ₹10,000-crore commercial paper and short-term loan facilities.

VRL has annual debt maturities of about \$3 billion each in fiscals 2024 and 2025, with high near-term maturities of \$1.7 billion in the first quarter of fiscal 2024.

The company is in discussion with lenders for refinancing upcoming maturities of the first quarter of fiscal 2024 and the same is expected to be completed by end of March 2023 or early April 2023, it said.

FROM THE FRONT PAGE

RBI assessing IDBI Bank bidders

Expressions of interest the first step in the stake sale the three people said.

The potential bidders have since begun due diligence on the bank, according to the people, who added financial bids were likely to be placed later this year.

The RBI is also conducting a "fit and proper evaluation", including extensive background and financial checks on the potential buyers, a crucial step before an investor is allowed to pick up a stake in a local bank, the

people added.

process — closed in January, raised questions around the extent of government control in IDBI Bank after the divestment since it will retain a 15% stake and LIC, a government company, will have a 19% stake, two of the people said. "The government does

> not intend to have any management control," one of the people said. "The government will take a call if a written submission to that effect is needed."

Buyers with an existing

Potential investors have merge the operation with IDBI eventually because RBI regulations do not allow the same investor to own two banking entities, said Ashvin Parekh, a management con-A merger would dilute

bank might be required to

the amount of equity held by the government and LIC, potentially reducing concerns over government control, he added.

Shares of IDBI Bank closed 9.66% higher on BSE

— REUTERS

Export slump sharpens, down 13.9% in March

Commerce and industry minister Piyush Goyal, who was on a visit to France and Italy from April 11-13, told reporters in Rome on Thursday that India's exports of goods and services together had scaled "new heights" and increased by 14% to \$770 billion in 2022-23 as against \$676 billion in 2021-22. The overall imports of goods and services touched \$892 billion in the last fiscal, the minister said, adding that it reflects that the country's economic activities are growing and that has supported the exports.

An official statement released by the commerce ministry here said: "Under merchandise exports, 13 of the 30 key sectors exhibited positive growth in March 2023 as compared to the same period last year." Among major sectors, these include iron ore (6.85%), drugs and pharmaceuticals (4.19%), electronic goods (57.4%), meat dairy and poultry products (3.44%) marine products (12.85%), fruits and vegetables 911.37%) and rice (10%).

Exports excluding petroleum and gems & jewellery (low value addition items) was \$30.2 billion in March, closer to the level of \$30.99 billion in the year ago month, indicating that the export decline was largely due to the fall in values of these products.

Tata, M&M market share at 10-yr high

Maruti Suzuki has said that constrained production due irregular supply of electronic components powered by semiconductors had impacted supplies to the market, thereby dispatching volume in FY23.

As per estimates, the Delhi-based company lost between 150,000 to 160,000 units to chip supply issues.

"Another factor that hurt Maruti Suzuki's share last year was its relatively low presence in the SUV segment where it only had the Brezza. But the upcoming Fronx and Jimny should help spruce up its overall share," said a Mumbaibased analyst.

Maruti Suzuki is targeting the pole position in the SUV segment with these two launches. As per the company's senior management, its total outstanding bookings stand at 380,000 units, which is at one of the highest levels in its history. A majority of the pending orders are for utility

vehicles. As per SIAM, the utility vehicle category, which includes SUVs, has retained the singlelargest tag in the PV market for the second consecutive year, as buyers' preference for SUVs over

hatchbacks continues to grow. SUVs made up 52% of the PV segment, compared to 49% in FY22. The share of passenger cars in FY23 stood at 45%, while in FY22 it was 48%.

300 mn tune in to IPL on TV, digital views at 5.5 bn

For the opening match, Disney-Star saw a growth of 31% in TV ratings along with a "Television continues to be the preferred

growth of 20% in reach compared to last year. medium for uninterrupted viewing of live cricket. All other media including digital are a

financialexp.epap.in

on Thursday.

complement to TV," Gupta said. On Monday, JioCinema, had said it had onboarded a record 23 sponsors for IPL in the first week. Star Sports, which is part of the Disney-Star network, said it had 13 sponsors for

the T20 tournament this year on TV. Advertisers on JioCinema include Dream11, PhonePe, Appy Fizz, Castrol, TVS, Oreo, Amazon, UltraTech Cement, Puma and Kamla Pasand, among others. While Disney-Star has brands such as Asian Paints, Mountain Dew, Britannia and Parle Biscuits advertising on its network.

Infosys follows TCS, misses Q4 Street estimates

"As the environment has changed, we see strong interest from our clients for efficiency, cost consolidation opportunities, resulting in a strong large deal pipeline. We have expanded our internal programme on efficiency and cost to build a path to higher margins in the medium term. We continue to invest in our people and in supporting our clients," Parekh said.

The company's attrition rate during the quarter dropped to 20.9% compared to 24.3% in the preceding quarter. The total employee count as of March 31 stood at 343,234, a drop of 3,611 employees from the

preceding quarter. The total value of large deals closed during the quarter stood at \$2.1 billion, whereas, for the entire fiscal it was \$9.8 billion.

In terms of clients, the company added two new clients in the \$100-million basket during the quarter, taking the total client count to 40 from 38 in the preceding quarter. The top five clients contributed 13% to the overall revenues during the quarter, while the top 10 clients contributed 20%.

The Infosys board approved a final dividend of ₹17.50 a share for FY23.

"Our continued focus on cost optimisation and operational efficiencies have helped in achieving operating margins of 21% in FY23. Free cash generation in Q4, led by robust collections, was strong. Executing on our capital allocation policy, we successfully completed the share buyback and have proposed a final dividend of ₹17.50 for FY23," chief financial officer, Nilanjan Roy said.

After the weak results, Infosys ADR fell 9%, its lowest levels since 2020.

Date: 13th April 2023

Place: Pune

Lamborghini launches ₹4.18-cr Urus S

ITALIAN SUPERCAR BRAND Lamborghini on Thursday launched the Urus S, which is the successor to the original Urus, one of the most expensive luxury SUVs in the country. The Urus S is priced at ₹4.18 crore (ex-showroom).

Powered by a 4.0-litre, twin-turbo V8 Euro 6 engine, the Lamborghini Urus S churns out peak power of 490kW and a top speed of 305 km per hour. The Urus S is made from

aluminum and composite material, making light-weight. Globally unveiled in Sep-

tember last year, this new variant of the Urus is positioned as a comfort-oriented

DCGI cancels

pharma companies have been

cancelled for manufacturing

spurious medicines following

an inspection by the Drugs

Controller General of India (DCGI) on 76 companies

across 20 states, sources said

70 companies in Himachal

Pradesh, 45 in Uttarakhand

and 23 in Madhya Pradesh

during the government crack-

down on companies manufac-

turing spurious medicines,

companies that manufactured

spurious medicines. According

to the list accessed by ANI,

most of the companies against

whom action has been taken

are registered in Uttarakhand

Dehradun, was suspended for

manufacturing with immedi-

ate effect from December 30,

2022 and permission for it to

manufacture 12 products

was cancelled on February 7

ufacturing notice was issued to

Shri Sai Balaji Pharmatech

from Baddi, Himachal Pradesh.

After verification of compli-

ance by Drug Inspectors, the

stop-manufacturing orderwas

Showcause and stop-man-

this year.

revoked.

The licence of Himalaya

and Himachal Pradesh.

Meditek, registered

ANI has accessed the list of

official sources said.

Action has been taken on

18 pharma

companies'

licences

on Thursday.

Lamborghini India head Sharad Agarwal at the launch

version and positioned below the track-focused Urus Performante.

Demand for supercars in India has found a strong traction, with 2022 sales growing

33% to 92 units over 2021, when it sold 69 units.

FE BUREAU

Air India to save 15K tonnes of jet fuel in 3 years with 'TaxiBots'

FE BUREAU New Delhi, April 13

THE LICENSES OF 18 AIR INDIA ON Thursday signed an agreement with KSU Aviation to launch 'Taxi-Bot' operations at the Delhi and Bengaluru airports for its Airbus A320 family of aircraft, seeking to save nearly 15,000 tonnes of jet fuel over three years.

A'TaxiBot'is a semi-robotic equipment, which once attached to the aircraft, acts as an extension of the aircraft's nose landing gear. It is used to tow aircraft

from the airport terminal gate to the taxi-out point and to tow aircraft from the terminal gate after landing (taxi-in phase)



without utilising the aircraft's engines, thus saving jet fuel.

According to the airline, this strategic partnership is aligned with its commitment to reduce its carbon footprint, as the adoption of 'TaxiBots' envisages a potential saving of 15,000 tonnes in fuel consumption over three years.

"This collaboration with

KSU will allow us to better assess the capabilities of 'Taxi-Bots', and potentially lead to greater deployment across Air India's subsidiaries and other airports," said Campbell Wilson, CEO & MD, Air India. Last year, the Air India

group entered into a memo-

randum of understanding (MoU) with the Council of Scientific and Industrial Research (CSIR)-Indian Institute of Petroleum to collaborate on the research, development, and deployment of sustainable aviation fuels (SAFs). In October 2019, Air India,

in a global first, used a TaxiBot on an Airbus A320 aircraft, operating a commercial flight with passengers on board.

SAJAN C KUMAR Chennai, April 13 **TAKING A STEP** further in its

used vehicle business, Hinduja flagship Ashok Leyland (ALL on Thursday launched its emarketplace for used commer cial vehicles (CVs), which will help customers in exchanging their old vehicles and upgrad ing them to new ALL trucks and buses. The e-marketplace, chris-

tened Re-AL, will offer customers a range of features to easily find vehicles of their choice, such as verified vehicle images and validated documents, as well as evaluation reports. Additionally, with a few clicks, sellers can list their vehicles for liquidation. Shenu Agarwal, MD & CEO,

ALL, said, "The used commercia vehicle industry is ripe for disruption. Leveraging our digital platforms, there are many opportunities for us to provide customer-centric solutions."

Indian Oil, Adani Total, Shell lap up Reliance's KG-D6 gas Reliance-BP on Wednes-

STATE-OWNED INDIAN OIL Corporation (IOC), Adani Total Gas and Shell were among the 29 companies that bid and bought natural gas to be produced from the deepest field in the KG-D6 block of Reliance Industries and BP, sources said.

IOC walked away with almost half of the 6 million standard cubic metres per day of gas sold in an e-auction on Wednesday, while stateowned gas utility GAIL

Indian Oil walked away with almost half of the 6 million standard cubic metres per day of gas sold in the e-auction

bought 0.7 mmscmd, Adani Total Gas 0.4 mmscmd, Shell 0.5 mmscmd, GSPC 0.25 mmscmd and IGS another 0.5 mmscmd, two sources with knowledge of the matter said.

day held an e-auction for sale of gas from the MJ field in their eastern offshore KG-D6 block after incorporating the government's new marketing rules to give CNG-selling city gas companies first priority over supplies.

The bidding saw participation from 41 companies from various sectors including city gas, fertiliser, oil refinery, glass, ceramics and traders, sources said. PTI

AICICI Securities Primary Dealership Limited

501B, First International Financial Centre (FIFC), Plot No. C 54 & 55, G Block, Bandra Kurla Complex (BKC), Bandra (East), Mumbai 400098.

CIN: U72900MH1993PLC131900, GST:: 27AAACI0995H1ZG AUDITED FINANCIAL RESULTS FOR THE YEAR ENDED MARCH 31, 2023

Quarter ended Year ended Particulars 4 8 1 March 31, 2023 March 31, 2022 March 31, 2023 March 31, 2022 (Audited) 2,015.9 13,743.0 10,480.3 Total Income from Operations 4,516.8 Net Profit/(Loss) for the period (before tax, exceptional and/or 4,424.8 extraordinary items) 81.1 1,744.6 Net Profit/(Loss) for the period before tax (after exceptional 558.6 4,424.8 1,744.6 and/or extraordinary items) Net Profit/(Loss) for the period after tax (after exceptional and/ or extraordinary items) 411.1 1,278.4 3,287.1 Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] 420.7 1,284.6 3,297.3 1,563.4 1,563.4 1,563.4 Paid-up equity share capital 1,563.4 Reserves (excluding Revaluation 14,259.0 14,334.2 14,259.0 14,334.2 Reserves) Securities Premium Account 15,822.4 15,822.4 15,897.6 15,897.6 Net worth 10 Paid up debt capital/outstanding 11 Outstanding Redeemable Preference Shares 12 Debt Equity Ratio 19.14 10.04 19.14 10.04 13 Earnings per share of Rs. 1,00,000/- each) (for continued and discontinued operations) -3,127.8 26,295.3 81,770.5 2,10,253.3 1. Basic: 2. Diluted: 3,127.8 26,295.3 81,770.5 2,10,253.3 14 Capital Redemption Reserve 466.6 466.6 466.6 466.6 15 Debenture Redemption Reserve 16 Debt Service Coverage Ratio 0.10 0.15 0.22 0.25 15.64 17 Interest Service Coverage Ratio 6.38 3.67 7.13 *EPS is not annualised for interim period

The above is an extract of the detailed format of quarterly/ annual financial results filed with the Bombay Stock Exchange under regulation 52 of the Listing Regulations. The full format of the quarterly/annual financial results is available on the websites of the Bombay Stock Exchange(www.bseindia.com) and the company (www.icicisecuritiespd.com). 2 For the other line items referred in regulation 52(4) of the Listing Regulations, pertinent disclosures have been made to the

Bombay Stock Exchange can be accessed on the URL (www.bseindia.com). 3 The financial results have been approved by the Board of Directors at its meeting held on April 12, 2023.

4 The Auditors' Report on the financial statements of the Company for the quarter and period ended March 31, 2023 is

The financial statements have been prepared as per the format prescribed in Division III of Schedule III of the Companies

6 The financial results have been prepared in accordance with the recognition and measurement principles of IND AS

prescribed under Section 133 of the Companies Act, 2013 read with relevant Rules issued thereunder and other accounting principles generally accepted in India. 7 There is no separate reportable segment for the Company as per IND AS 108 - 'Operating Segments'.

9 The Board of Directors at its meeting held on April 19, 2022 had recommended final dividend amounting to ₹ 1,360.2 million (₹ 87,000/- per equity share) for the year ended March 31, 2022. The same was approved by the shareholders in

8 There have been no deviations, in the use of proceeds of issue of debt securities from the objects stated in the offer

the annual general meeting held on June 17, 2022. This dividend has been paid on June 22, 2022. D The Board of Directors at its meeting held on April 12, 2023 have proposed final dividend on equity shares amounting to ₹ 766.1 million (₹ 49,000/- per equity share) for the year ended March 31, 2023. Payment of this final dividend is subject to

the approval of the shareholders in the annual general meeting of the Company. For and on behalf of the Board of Directors

> Shailendra Jhingan Managing Director & CEO

Mumbai, April 12, 2023

Suzlon Energy Limited

ANI

Registered Office: "Suzlon", 5, Shrimali Society, Near Shri Krishna Complex, Navrangpura, Ahmedabad - 380 009, Gujarat, India; Tel: +91 79 6604 5000; Corporate Office: One Earth, Hadapsar, Pune - 411 028, Maharashtra, India Tel: +91 20 6702 2000, Contact Person: Geetanjali S. Vaidya, Company Secretary and Compliance Officer

release, directly or indirectly, in the United States of America or otherwise outside India. This is not an offer document. All capitalised terms used and not defined herein shall have the meaning assigned to them in the Letter of Offer dated 28" September 2022 read with addendum dated 10th October 2022 filed with BSE Limited ('BSE') and the National Stock Exchange of India Limited ('NSE'), the stock exchanges where the Equity Shares of the Company are presently listed (BSE and NSE hereinafter together referred to as the "Stock Exchanges") and Securities and Exchange Board of India ('SEBI')

FIRST REMINDER-CUM-FORFEITURE NOTICE TO THE HOLDERS OF PARTLY PAID-UP EQUITY SHARES ON WHICH CALL MONEY IS TO BE PAID (ISIN :IN9040H01011)

thereunder, the First and Final Call Notice has been issued to such persons who were members of the Company on 2[™] March 2023, being the Record Date. The call payment period has since

In this connection, the Securities Issue Committee of the Board of Directors of the Company (the "Committee"), duly authorised by the Board of Directors of the Company, at its meeting held on 29th March 2023, approved sending Reminder-cum-Forfeiture Notice from time to time for payment of the First and Final Call amount of ₹2.50 per partly-up equity share (comprising ₹1.00 towards face value and ₹1.50 towards securities premium) ("Reminder-cum-Forfeiture Notice"), to the holders of such partly paid-up equity shares on which the First and Final Call Money remains unpaid for payment of such unpaid First and Final Call along with interest @ 8% p.a., from

paid the call money has been initiated on 13th April 2023.

The payment period is from Saturday, 15th April 2023 to Saturday, 29th April 2023 (both days

 a) By net-banking / UPI through the R-WAP portal: https://rights.kfintech.com/callmoney. Kindly note that the interest amount is pre-computed when you make payment through the R-WAP

Please note that, failure to pay the First and Final Call Money, as aforesaid, shall render the partly paid-up equity shares of the Company, including the amount already paid thereon, liable to be forfeited in accordance with the provisions of the Act, the Articles of Association of the Company and the Letter of Offer. Further, interest @8.00% (Eight percent only) p.a. will continue to be charged for delay in payment of the First and Final Call from 24th March 2023 till date of actual payment of the First and Final Call. The Company shall be entitled to deduct from any dividend

All correspondence in this regard may be addressed to: KFin Technologies Limited, Unit: Suzlon Energy Limited, Selenium Tower B, Plot No. 31 and 32, Financial District, Nanakramguda, Rangareddi - 500032, Telangana, India; Contact person; Mr. M. Murali Krishna Tel: +91 40 6716 2222; Toll Free No. 1800 309 4001 (operational from Monday to Saturday between 9 a.m. and

For Suzlon Energy Limited

E-mail: investors@suzlon.com; Website: www.suzlon.com; Corporate Identity Number: L40100GJ1995PLC025447

This is only an Advertisement for the information purpose and not for publication, distribution, or

In terms of provisions of the Companies Act, 2013 ('Act'), read with the relevant rules made expired on 23" March 2023.

24" March 2023 till date of actual payment of the First and Final Call.

Accordingly, sending of First Reminder-cum-Forfeiture Notice to all the members who have not

inclusive). Payment is to be made as under:

portal. b) By demand draft made payable to "Suzlon Energy Limited – Right Allotment Account"

payable to such members, if any, all sums of money outstanding on account of calls and interest due thereon in relation to the partly paid-up equity shares of the Company.

5 p.m.) E-mail id: einward.ris@kfintech.com.

Sd/-

Geetanjali S. Vaidya Company Secretary

656500, 715255 for 1000 shares bearing distinctive No(s) 267929951-267930450, 537290901 537291400 standing in the name(s) of GURBAX SINGH SEHGAL in the book of M/s BAJAJ FINANCE LIMITED. has/have been lost/misplaced/destroyed and the advertiser has/have applied to the company for issue of duplicate share certificate(s) in lieu thereof. Any person(s) who has/have claim(s) on the said shares should lodge such claim with the company at its registered office 4th Floor, Bajaj Finserv Corporate Office, Off Pune-Ahmednagar Road, Viman Nagar, Pune-411 014 within 15 days from the date of this notice failing which the company will proceed to issue duplicate share certificate(s) in respect of the Name(s) of the Claimant(s): Date: 14.04.2023 Satish Chander Sengal Place : Delhi **Suresh Chander Sehgal**

acceptance of advertising copy, it is not possible to verify Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in

any manner whatsoever.

फॉर्म ए सार्वजनिक सूचना (भारतीय दिवाला एवं शोधन अक्षमता बोर्ड के विनियम 6 के अंतर्गत)

डी.डी. इंडस्ट्रीज लि. (डीडी मोटर्स के नाम से जाना जाने वाला डिवीजन)के लेनदारों के ध्यानार्थ

	ાંના આંગ વાલા હિવાએમું લેગવારા જે વ્યાનાથ						
	प्रासागक विवरण						
	कॉर्पोरेट देनदार का नाम	डी.डी. इंडस्ट्रीज लि. (डीडी मोटर्स के नाम से जाना जाने वाला डिवी जन)					
2.	कॉर्पोरेट के निगमन की तिथि	30 मार्च 1974					
L	प्राधिकरण जिसके तहत कॉर्पोरेट देनदार निगमित/पंजीकृत है	कंपनी रजिस्ट्रार, नई दिल्ली					
	कॉर्पोरेट पहचान संख्या / कॉर्पोरेट देनदार की सीमित देयता पहचान संख्या	U74899DL1974PLC007169					
5.	कॉर्पोरेट देनदारों के पंजीकृत कार्यालय और प्रधान कार्यालय (यदि कोई हो) का पता	बी–84, मायापुरी इंडस्ट्रियल एरिया फेज–1, नई दिल्ली–110064					
	कॉरपोरेट देनदार के संबंध में दिवाला प्रारंभ होने की तिथि	12 अप्रेल 2023					
	दिवाला समाधान प्रक्रिया के बंद होने की अनुमानित तिथि	9 अक्टूबर 2023 (समाधान प्रक्रिया शुरू होने की तारीख से 180वां दिन)					
	अंतरिम समाधान पेशेवर के रूप में कार्य करने वाले दिवाला पेशेवर का नाम और पंजीकरण संख्या	म ोज कुमार आनंद पंजी सं: IBBI/IPA-001/IP-P00084/2017-2018/10180					
9.	अंतरिम समाधान पेशेवर के साथ पत्राचार के लिए उपयोग किया जाने वाला पता और ई—मेल	पंजीकृत पताः 2, सामुदायिक केंद्र, तीसरी मंजिल, (पीवीआर / मैकडॉनल्ड के पास), नारायणा ,नई दिल्ली—110028 ईमेल—anandmanoja@gmail.com					
10.	अंतरिम समाधान पेशेवर के साथ पत्राचार के लिए उपयोग किया जाने वाला पता और ई—मेल	2, सामुदायिक केंद्र, तीसरी मंजिल, (पीवीआर / मैकडॉनल्ड के पास), नारायणा ,नई दिल्ली—110028 ईमेल—ddindustriescirp@gmail.com					
11.	दावे प्रस्तुत करने की अंतिम तिथि	28 अप्रैल, 2023					
	अंतरिम समाधान पेशेवर द्वारा सुनिश्चित धारा 21 की उप—धारा (6ए) के खंड (बी) के तहत लेनदारों के वर्ग, यदि कोई हो,	वर्गों का नामः लागू नहीं					
	.ऋणशोधन अक्षमता पेशेवरों के नाम जिन्हें एक वर्ग में ऋणदाताओं के अधिकृत प्रतिनिधि के रूप में कार्य करने के लिए चिह्नित किया गया है।(प्रत्येक वर्ग के लिए तीन नाम)						
14.	(क) प्रासगिक प्रपत्र और (ख)अधिकृत प्रतिनिधियों का विवरण यहां उपलब्ध है	क) वेब लिंकः https://ibbi.gov.in/downloadform.html (ख) लागू नहीं					

एतद्वारा सूचना दी जाती है कि राष्ट्रीय कंपनी कानून ट्रिब्यूनल, नई दिल्ली, बेंच $-{
m VI}$, नई दिल्ली ने बुधवार, 12 अप्रैल, 2023 को कंपनी याचिका संख्या आईबी –663 / पीबी / 2022 के विरुद्ध आदेश के अनुसार मैसर्स डी.डी. इंडस्ट्रीज लि.(डीडी मोटर्स के नाम से जाना जाने वाला डिवीजन) की कॉर्पोरेट दिवाला समाधान प्रक्रिया शुरू करने का आदेश दिया है।

मैसर्स डी.डी. इंडस्टीज लि.(डीडी मोटर्स के नाम से जाना जाने वाला डिवीजन) के लेनदारों को सबूत के साथ अपने दावे प्रस्तुत करने के लिए शुक्रवार, 28 अप्रैल, 2023 को या उससे पहले प्रविष्टि संख्या 10 के सामने उल्लिखित पते पर अंतरिम समाधान पेशेवर को कहा जाता है। वित्तीय लेनदारों को अपने दावों को केवल इलेक्ट्रॉनिक माध्यम से प्रमाण के साथ प्रस्तुत होगा। अन्य सभी लेनदार कॉलम 14 में उल्लिखित वेब लिंक से डाउनलोड किए जाने वाले प्रासंगिक प्रपत्रों में व्यक्तिगत रूप से, डाक द्वारा या इलेक्ट्रॉनिक माध्यम से प्रमाण के साथ दावे प्रस्तुत कर

दावे के झूठे या भ्रामक प्रमाण प्रस्तुत करने पर दंड लगाया जाएगा।

मनोज कुमार आनंद मैसर्स डी.डी. इंडस्ट्रीज लि

(डीडी मोटर्स के नाम से जाना जाने वाला डिवीजन) के अंतरिम समाधान पेशेवर दिनांक: 14.04.2023. स्थान : नई दिल्ली पंजीकरण संख्याः IBBI/IPA-001/IP-P00084/2017-2018/10180

सुप्रीम हाउसिंग फाइनेंस लिमिटेड

[(परिशिष्ट IV) नियम 8(1)]

जबिक, अधोहस्ताक्षरी, वित्तीय संपत्तियों के प्रतिभृतिकरण और पुनर्निर्माण तथा प्रतिभृति हित अधिनियम, 2002 (2002 का 54) (इसके बाद "सरफेसी अधिनियम, 2002" के रूप में संदर्भित) के तहत मैसर्स सुप्रीम हाउसिंग फाइनेंस लिमिटेड, राष्ट्रीय आवास बैंक अधिनियम के तहत एक हाउसिंग फाइनेंस बैंक कंपनी, वर्तमान में यह दूसरी मंजिल, 13/29, ब्लॉक-ई, हर्ष भवन, मध्य सर्कल, कनॉट प्लेस, नई दिल्ली -110001 में पंजीकृत है, (इसके बाद "एसएचएफएल" वे रूप में संदर्भित))के अधिकृत अधिकारी होने के नाते और प्रतिभृति हित (प्रवर्तन) नियम 2002 के नियम 3 के साथ पठित धारा 13(12) के तहत प्रदत्त शक्ति का प्रयोग करते हुए नोटिस में उल्लिखित राशि को चुकाने के लिए निम्नलिखित (उधारकर्ताओं) और (सह उधारकर्ताओं) को उक्त नोटिस की प्राप्ति की तारीख से 60 दिनों के भीतर चुकाने के लिए कहा गया है। ऋणीध् गारंटरों ने राशि चुकाने में विफल रहे हैं, ऋणकर्ता और आम जनता को एतद्दवारा नोटिस दिया जाता है कि अधोहस्ताक्षरी ने प्रतिभृति हित प्रवर्तन नियम 2002 के नियम 8 के साथ पठित अधिनियम की धारा 13 की उप–धारा (4) के तहत उसे प्रदान की गई शक्तियों का प्रयोग करते हुए नीचे वर्णित संपत्ति पर निम्नलिखित तारीखों के अनुसार कब्जा ले लिया है।

न करें और संपत्ति के साथ किसी भी तरह का लेन–देन "एसएचएफएल" को राशि ,उस पर ब्याज ,अन्य व्यय वे प्रभार के अधीन होगा। प्रतिभृति संपत्तियों को भूनाने के लिए उपलब्ध समय के संबंध में अधिनियम की धारा 13 के

उधारकर्ता / सह–उधारकर्ता का नाम और पताः 1. मेहराम गुर्जर पुत्र नंदा राम गुर्जर, रामनगर, नितूटी, अजमेर, रूपनगढ़, राजस्थान — 305814, फोन नं. 9521274345, यहां भीः — ग्राम पंचायत, पनेर, पंचायत, समिति, रूपनगढ़– 305814, 2. संतोष पत्नी मेहराम गुर्जर, गणु, रामनगर, नितूटी, अजमेर, राजस्थान 305814, फोन नं. 7568347153, 3.राजुराम पुत्र देवकरण, मकान नं. 411, उगुनी धानी, टायोड, ग्राम टायोड, तेह.– रूपनगढ़, जिला – अजमेर,

मांग नोटिसः 24—जनवरी—23

संपत्ति का विवरणः ग्राम रामनगर, ग्राम पंचायत पनेर, जिला अजमेर, राजस्थान में स्थित आबादी भूमि का वह सभी टुकड़ा और अंश। पूर्व की ओर से 31 फीट, पश्चिम की ओर से 31 फीट, 86 फीट उत्तर की ओर से और दक्षिण की ओर से 86 फीट यानी कुल 296.22 वर्ग गज में, चौहद्दी इस प्रकार : पूर्वः श्री किशन पूत्र गंगाराम गूर्जर का मकान, पश्चिमः आम रास्ता , उत्तरः श्री राजू पुत्र हीरालाल जाट का मकान , दक्षिणः रामदेव पुत्र काना का मकान,

उधारकर्ता / सह—उधारकर्ता का नाम और पताः 1. बाबू लाल कुमावत पुत्र किशन लाल कुमावत, बोदियों की ढाणी, खारदिया, नागौर, राजस्थान— 341509, फोन नं. 9983665032, यहां भी:– बी.एल.के.कांट्रेक्टर बोदियों की ढाणी, खारदिया, नागौर, राजस्थान— 341509, 2. मोहनी देवी पत्नी बाबू लाल कुमावत, बोदियों की ढाणी, खारदिया, नागौर, राजस्थान — 341509, फोन नं. 9828877135, 3. फत्तू राम पुत्र जीवन राम, 108, नागा की धानी, कसेडा, नागौर,

मांग नोटिस दिनांकः 21–दिसंबर–22

मांग नोटिस की राशिः रु. 16,48,404 / – (रुपये सोलह लाख अडतालीस हजार चार सौ चार मात्र) **संपत्ति का विवरण:** 333.33 वर्ग गज मापक्षेत्र के भुखंड के सभी टुकड़े और अंश। खसरा सं. 393 के (हिस्से का हिस्सा.ग्राम खारदिया, तहसीलः नावा, जिला नागौर, राजस्थान।

प्राधिकृत अधिकारी-कृते सुप्रीम हाउसिंग फाइनेंस लिमिटेड

चौथी मंजिल, टॉवर ३, इक्विनॉक्स बिजनेस पार्क, एलबीएस रोड, कुर्ला, मुंबई ४०००७०

अचल संपत्तियों की बिक्री के लिए बिक्री सचना

प्रतिभृति हित (प्रवर्तन) नियम, 2002 के नियम 8 और 9 के परंतुक के साथ पठित वित्तीय संपत्तियों के प्रतिभृतिकरण और पुनर्निर्माण और प्रतिभृति हित प्रवर्तन अधिनियम, 2002 के तहत अचल संपत्ति(यों) ['प्रतिभत आस्ति(यों)'] की बिक्री के लिए 15 दिनों की ई-नीलामी बिक्री सचना

जनसामान्य को और विशेष रूप से कर्जदारों और गारंटरों को नोटिस दिया जाता है कि यू ग्रो कैपिटल लिमिटेड ('प्रतिभृत लेनदार') के पास बंधक/प्रभारित नीचे वर्णित प्रतिभृत आस्ति(यां), जिसका कब्जा प्रतिभृत लेनदार के अधिकत प्राधिकारी द्वारा कर लिया गया है, यहां नीचे उल्लिखित बकायों तथा भावी ब्याज एवं अन्य व्यय और राशि की वसूली तक यहां नीचे उल्लिखित कर्जदार(रों) तथा जमानती(यों) से प्रतिभृत लेनदार के बकाये की वसूली के लिए सम्पत्ति की बिक्री ''जैसा है जहां है'', ''जहां है जैसे'' तथा ''जो कछ भी है वहीं है'' आधार पर की जायेगी। आरक्षित मल्य, जमा धरोहर राशि (ईएमडी) तथा ईएमडी जमा करने की अन्तिम तिथि नीचे उल्लिखित है :

कर्जदार(रों)/जमानती(यों) का विवरण	मांग सूचना का विवरण	नीलामी की विवरण
ग्लोबल एजेंसीज श्रीमती स्नेहलता बस्सी उ. श्रीमती स्नेहलता बस्सी उ. कपलिश पॉलीमर इंडस्ट्रीज प्राइवेट लिमिटेड कर्जदार अीमती सनेहलता बस्सी उ. सुश्री विधि बस्सीकानूनी वारिस ऋण खाता संख्याः HCFDELSEC00001003925	सूचना की तिथि : 19-07-2022 बकाया राशि : रु. 95,71,158/- तिथि 19-07-2022 तक	आरिक्षत मूल्य (आवासीय फ्लैट) रु. 37,80,000/- आरिक्षत मूल्य (वाणिज्यिक दुकान) रु. 55,80,000/- ईएमडी (आवासीय फ्लैट) रु. 3,78,000/- ईएमडी (वाणिज्यिक दुकान) रु. 5,58,000/- ईएमडी जमा की अंतिम तिथि 29-04-2023 नीलामी की तिथि 08-05-2023 नीलामी का समय 10 बजे पूर्वा 1 बजे अप. वृद्धि मूल्य रु. 1,00,000/-
गविश्व अधिवयों का विवस्ता.		

आवासीय फ्लैट : फ्लैट नं. 203, प्रथम तल, ब्लॉक नं. 5, सेक्टर ओमिक्रॉन-1ए, ग्रेटर नोएडा-201306 वाणिज्यिक दुकान : 120, प्रथम तल, एलएससी पॉकेट डी एवं ई, मार्केट सरिता विहार, दिल्ली-110 076

कर्जदार(रों)/जमानती(यों) का विवरण	मांग सूचना का विवरण	नीलामी की विवरण		
1. प्रवीण इन्फोटेक	सूचना की तिथि :	आरक्षित मूल्य	₹. 55,00,000/-	
2. श्री मोहित गुप्ता	14-02-2022	ईएमडी	₹. 5,50,000/-	
3. श्रीमती पुनीता गुप्ता		ईएमडी जमा की अंतिम तिथि	29-04-2023	
ऋण खाता संख्या : HCFDELSEC00001005148	बकाया राशि : रु.	नीलामी की तिथि	08-05-2023	
IICI DEESECOOOTIOO5140	22,63,305/- तिथि	नीलामी का समय	11 बजे पूर्वा. से 1 बजे अप.	
	14-02-2022 तक	वृद्धि मूल्य	रु. 1,00,000/−	

प्रतिभूत आस्तियों का विवरणः

प्लॉट नंबर 17. खसरा नंबर 532. ग्राम फफराना, परगना जलालाबाद, तहसील मोदीनगर, गाजियाबाद, उत्तर प्रदेश – 201 204 की अचल संपत्ति का समस्त भाग (विशेष रूप से स्वामित्व दस्तावेजों में वर्णित)

बिक्री के विस्तृत नियमों एवं शर्तों के लिए कृपया यू ग्रो कैपिटल लिमिटेड/प्रतिभूत लेनदार की वेबसाइट में प्रावधानित लिंक अर्थात www.ugrocapital.com देखें या अधोहस्ताक्षरी से authorised.officer@ugrocaprtal.com पर सम्पर्क करें।

ह./- साबिया मलिक स्थान : रा.रा.क्षे. (अधिकृत प्राधिकारी) तिथि : 14-04-2023 कृते यु ग्रो कैपिटल लिमिटेड

इंडियन बैंक Indian Bank **∆** इलाहाबाद

The Indian EXPRESS

Hook at every side before taking a side.

For the Indian Intelligent

दिनांक- 13.04.2023

अचल सम्पत्ति के लिए मेरठ विश्वविद्यालय, मेरठ जबकि, अधोहरताक्षरी, प्राधिकृत अधिकारी, इंडियन बैंक (पूर्ववर्ती इलाहाबाद बैंक) वित्तीय आस्तियों का प्रतिभूतिकरण और पुनर्गठन तथा प्रतिभूति हित का प्रवर्तन अधिनियम, 2002 (2002 का 64 के अधीन औ धारा 13(12) तथा सपठित प्रतिभृति हित (प्रवर्तन) नियम 2002 के नियम 3 के अधीन प्रदत्त शक्तियों के प्रयोग में उधारकर्ती / जमानतकर्ता को विवरण नीचे दिये गये कोलम में सुचना में उल्लिखित रकम को

कथित सूचना की प्राप्ति की तिथि से 60 दिनों के भीतर पुनसंदत्त करने के लिए बुलाते हुए एक माँग देय सूचना निम्नलिखित दिनांक को जारी किया । उधारकर्ता / जमानतकर्ता द्वारा राशि का पुनर्मुगतान करने में असफल रहने पर, प्रतिभूत हित (प्रवर्तन) नियम, 2002 की धारा 8 के साथ पठित अधिनियम की धारा 13 की उपधारा (4) के अंतर्गत प्रदर क्तियों का प्रयोग करते हुए एतदद्वारा उधारकर्ती और आम लोगों को यह नोटिस दिया जा रहा है कि अधोहरताक्षरी ने नीचे उल्लेख की गई सम्पत्ति पर दिनांक से सांकेतीक कब्जा कर लिया है । ऋणी को विशेष रूप से और लोक को सामान्य रूप से एतदहारा सम्पत्ति से संव्यवहार न करने के लिए सावधान किया जाता है और सम्पत्ति का कोई संव्यवहार इं**डियन बैंक** के प्रभार के अधीन होगा धारकर्ता 🗸 गारंटीकर्ता का ध्यान प्रतिभत आहितयों के मोचन के लिए उपलब्ध समय के संदर्भ में अधिनियम की धारा 13 की उपधारा (8) के उपबंधों की और आकष्ट किया जाता है।

शाखाः-

ऋणी / गारंटर का नाम व पता	बंधक सम्पत्ति का विवरण	मांग नोटिस की तिथि	वकाया राशि
शास्त्री नगर, मेरेठ —250004, 2. श्री बलवीर सिंह पुत्र श्री भवर सिंह निवासी 407 सेक्टर 2, शास्त्री नगर, मेरेठ —250004, 3. श्रीमती लता शर्मा पत्नी श्री अशकीन शर्मा निवासी मकान	ईंडब्ल्यूएस मकान नं. 407 / 2, (क्षेत्रफल 24.56 वर्ग मीटर) स्थित सेक्टर 2, योजना संख्या 07, शास्त्री नगर, मेरठ और सीमायें:— पूर्व 5.55 मीटर / मकान संख्या 408 / 2, पश्चिम: 5.55 मीटर / मकान संख्या 406 / 2, उत्तर: 4.425 मीटर / संपत्ति संख्या 310 / 2, दक्षिण: 4.425 मीटर / खुला क्षेत्र मालिक / शीर्षक धारक: श्रीमती अन्तू पत्नी श्री बलवीर सिंह	कब्जा नोटिस	+ ब्याज + अन्य खर्चे

SALE NOTICE

स्थान -मेरठ

(For Sale of Assets through e-auction mode in accordance with the provision of the Insolvency and Bankruptcy Code, 2016 and rules & regulations made thereunder)

> In the matter of: **AMITECH TEXTILES LIMITED - IN LIQUIDATION**

[THE CORPORATE DEBTOR HAVING ITS REGISTERED OFFICE AT ARAZI NO. 153, AMITECH INDUSTRIES COMPLEX, VILLAGE KHANCHANDRAPUR, TEHSIL AKBARPUR, POST RANIA, KANPUR DEHAT, UTTAR PRADESH-209304UNDER GOING LIQUIDATION PROCESS VIDE ORDER DATED 16-03-2022 PASSED BY THE HON'BLE NATIONAL COMPANY LAW TRIBUNAL, ALLAHABAD BENCHAT ALLAHABAD IN ACCORDANCE WITH THE PROVISIONS OF THE INSOLVENCY AND BANKRUPCTY CODE, 2016]

NAME OF LIQUIDATOR: CS SHRAVAN KUMAR VISHNOI

Date of e-auction: 12th May, 2023

Timing: 12:00 PM to 03:00 PM (with unlimited extension of 5 minutes each)

Contact Person: Mr. Shravan Kumar Vishnoi @ +91-9839443555 Notice is hereby given to the public in general that the subject matter detailed as

below, forming part of the Liquidation Estate in the matter of M/s Amitech Textiles Limited - In Liquidation, which is prepared by the Liquidator, appointed vide order dated 16-03-2022, passed by the Hon'ble NCLT, Allahabad Bench at Allahabad and will be sold on "AS IS IT IS" "AS IS WHERE IS" "AS IS WHAT IS" and "WITHOUT RECOURSE BASIS" through e-auction in accordance with the provisions of the Insolvency and Bankruptcy Code, 2016 and related rules & regulations made thereunder.

Block	Subje	ct Matter o	f Sale	Reserve Price (In Rs.)	Earnest Money Deposit (In Rs.)
A	The Liquidator in consultation with the stakeholders has decided for sale of the corporate debtor as going concern i.e. the corporate identity of the corporate debtor will continue to exist. The following transaction will take place to the effect. a. Acquisition of the business of the corporate debtor as going concern. b. Acquisition of all immovable /movable / tangible/intangible assets of the corporate debtor. c. Acquisition of all investments made by the corporate debtor. Description of Assets: a. Factory Land and Building situated at Vill: Khanchandpur, Tehsil: Akbarpur, District: Kanpur			Rs. 11,25,11,317/-	Rs. 1,12,51,132/-
	a. Factory Lan Khanchandpur,	d and Building			
	a. Factory Lan Khanchandpur, Dehat:	d and Building Tehsil: Akbarpur			
	a. Factory Lan Khanchandpur,	d and Building	District: Kanpur		
	a. Factory Lan Khanchandpur, Dehat: Sale Deed 8084/ 02.11.2012	Gata No. 237, 152, 157, 159kha, 160, 161, 162, 163	Area (In Hectare)		
	a. Factory Lan Khanchandpur, Dehat: Sale Deed 8084/ 02.11.2012	Gata No. 237, 152, 157, 159kha, 160, 161, 162, 163 & 164ka	Area (In Hectare)		
	a. Factory Lan Khanchandpur, Dehat: Sale Deed 8084/ 02.11.2012	Gata No. 237, 152, 157, 159kha, 160, 161, 162, 163 & 164ka 155min, 156min, 155ga, 158, 85/418, 183ga, 138chha	Area (In Hectare)		
	a. Factory Lan Khanchandpur, Dehat: Sale Deed 8084/ 02.11.2012 6028/ 25.09.2012	Gata No. 237, 152, 157, 159kha, 160, 161, 162, 163 & 164ka 155min, 156min, 155ga, 158, 85/418, 183ga, 138chha	Area (in Hectare) 1.491 0.60922		

The eligible participants/interested parties may express/submit their interest and participate in e-auction process for sale of the assetsin the manner & subject to terms & conditions detailed below:

Important Terms and Condition of the E-Auction:

- E-Auction will be conducted on "AS IS IT IS" "AS IS WHERE IS", "AS IS WHAT IS" "WHATEVER IS THERE IS" and "WITHOUT RECOURSE BASIS" through approved service provider Linkstar Infosys Private Limited.
- This Sale Notice shall be read in conjunction with the complete E-Auction Process Document containing details of the assets, online e-auction bid form, declaration and undertaking forms, general terms and conditions of the e-auction Sale, which can be downloaded from www.eauctions.co.in or may be obtained by sending an email to liquidatoramitech@gmail.com
- 3. The intending bidders, subject to Point No.3 and 4 of important terms and conditions of this sale notice, should submit EoI documents to the office of the Liquidator on or before 29th April 2023 either electronically via e-mail at liquidatoramitech@gmail.com or physically at the address given below:

Address for Communication:

BCC Tower, 1008,10th Floor, Arjun Ganj, Near Shaheed Path, Lucknow, Uttar Pradesh ,226002

- 4. The Name of the Eligible Bidders will be identified by the Liquidator to participate in E-Auction on or before 1st May, 2023. The E-Auction Service Provider will provide User ID and Password through E-mail to all the Eligible Bidders.
- The eligible participants may inspect/visit the properties/assets, at their own expenses, from date 1st May, 2023 to 8th May, 2023, after taking a prior approval/appointment from the office of the Liquidator.
- The intending bidders are required to deposit Earnest Money Deposit (EMD) amount, on or before 10th May, 2023, either by deposit of amount through Cheque/or NEFT/ or RTGS, in the bank account as detailed hereunder; or through DD drawn on any Scheduled Bank in the name of AMITECH TEXTILES TLIMITED- IN

Bank Name and Branch: Bank of India, Kanpur SSI Branch Name of Account: AMITECH TEXTILES LIMITED IN LIQUIDATION. Account Number: 695920110000651 IFSC Code: BKID0006959

The intending bidders, prior to submitting their bid, shall make their independent inquiries and satisfy themselves in every possible manner; and thereafter the Liquidator cannot be held liable to bear/reimburse any expense, loss or damage incurred, if any, in any manner, to the intending/ prospective bidders in the process. 8. The Liquidator has absolute right to accept or reject any or all bids or adjourn/postpone/cancel the E-Auction or withdraw any property or portion thereof from the E-Auction at any stage without assigning any reason thereof.

The Bidder/s hereby agrees, jointly and/or severally, to indemnify and save the Liquidator, harmless from and against any claims, demands, actions, causes of action, damage, loss, deficiency, cost, liability and expense which may be made or brought against the Liquidator or which the Liquidator may suffer or incur as a result of, in respect of or arising out of any non-performance or non - fulfilment of any covenant or agreement on the part of the Vendors contained in this Agreement or any misrepresentation, inaccuracy, incorrectness or breach of any representation or warranty made by the Bidder/s.

The Sale shall be subject to the provisions of the Insolvency and Bankruptcy Code, 2016 and Regulations made thereunder.

> (CS Shravan Kumar Vishnoi) Liquidator in the matter of Amitech Textiles Limited Reg. No.: IBBI/IPA-002/IP-N00040/2016-2017/10079 AFA No: AA2/10079/02/221123/202367 Address: BCC Tower, 1008, 10thFloor, Arjun Ganj, Near Shaheed Path, Lucknow, Uttar Pradesh, 226002

Date: 14-04-2023 Email ID: shravan.vishnoi@yahoo.com, liquidatoramitech@gmail.com 'IMPORTANT''

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such ntents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications.
We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner पहचान की अपील



सर्वसाधारण को सूचित किया जाता है कि एक अज्ञात व्यक्ति जिसका नामः नामालूम पुत्र नामालूम निवासी नामालूम, उम्र : लगभग 35 साल, कद : 5'4", रंग : सांवला, **चेहरा** : अण्डाकार, **शरीर** सामान्य, कपडे : क्रीम रंग की शर्ट और नीले रंग का लोवर पहने हुए है, जो दिनांक 06.04.2023 को सदर लायन्स आई हॉस्पिटल के सामने फुटपाथ पर, ए-ब्लॉक,

जहांगीर पुरी, दिल्ली में मृत अवस्था में पाया गया है। इस संदर्भ में डीडी सं. ८ए दिनांक 06.04.2023 थाना महेन्द्र पार्क, दिल्ली में दर्ज है।

यदि किसी भी व्यक्ति को इस मृत व्यक्ति के बारे में कोई जानकारी या सुराग मिले तो निम्नलिखित को सूचित करने की कृपा करें-

थानाध्यक्ष :

थाना महेन्द्र पार्क, दिल्ली उत्तर पश्चिमी जिला, दिल्ली DP/3972/NW/2023 दूरभाष सं. 011-27632501, 7428139095

कार्यालय नगर पालिक निगम, खण्डवा (म.प्र.) ४५०००१ स्वच्छता एवं ठोस अपशिष्ट प्रबंधन विभाग)

कमांक- 268/ स्वा.वि./ ई-टेण्डरिंग/2023/24 -:: निविदा विज्ञप्ति ::-

खण्डवा, दिनांक-13/04/2023

निम्नलिखित कार्य हेतु निविदा ऑनलाईन आमंत्रित की जाती है, उल्लेखित कार्य की निविदा का विस्तृत वेबसाईट http://www.mptenders.gov.in पर देखा जा सकता है।

क्र.	ऑन लाईन पोर्टल	कार्य का नाम	अनुमानित लागत (लाख में)	धरोहर राशि	निविदा प्रपत्र की राशि	कार्य पूर्ण करने की अवधि
1	2	3	4	5	6	7
1		Selection of Contractor for The Work of "Legacy Waste Dumpsite Remediation through Bioremediation, Biomining and disposal of Residual waste" in Nagar Nigam Khandwa.	Lacs	3,49,247/-	20,000/-	240 दिन

निविदा ऑनलाईन क्रय एवं प्रस्तुत करने की अंतिम दिनांक निविदा खोलने की दिनांक

प्राधिकृत अधिकारी

:- 15/05/2023 (शाम 5:30 बजे तक)

:- 17/05/2023 (प्रातः 10:30 बजे) निविदा संबंधी समस्त जानकारी वेबसाईट http://www.mptenders.gov.in पर देखी जा सकती है। निविदा में यदि किसी भी प्रकार का संशोधन किया जाता है तो वह वेबसाइट पर देखा जा सकता हैं।

> आयुक्त नगर पालिक निगम, खण्डवा

TOSHA INTERNATIONAL LIMITED

CIN:L32101DL1988PLC119284;

Regd. Office: E-34 Second Floor, Connaught Circus, New Delhi 110001; **Tel No.**: +91 9266673204/05/06, +91-11-42670495; **Email**: toshainternational@yahoo.com; **Website**: www.toshainternational.com;

NOTICE

Notice is hereby given to all the public shareholders of Tosha International Limited ("Company") that the Company has initiated the process of voluntary delisting of its equity shares from the Calcutta Stock Exchange Limited i.e., the only Stock Exchange where the equity shares of the Company are listed. The delisting proposal has been approved by the shareholders through postal ballot and remote e-voting results of which were declared on 15.07.2022. The Promoter Acquirer has given a Delisting Offer at the Floor Price of Rs. 3/- (Rupees Three Only) for each fully paid-up equity share and Rs. 1.50 (Rupee One and Fifty Paise Only) for each partly paid-up equity share for providing an exit opportunity to all the public shareholders. Thus, the public shareholders of the Company are hereby requested to kindly update their address, contact details and email IDs with the Company/ Skyline Financial Services Private Limited ("Registrar" of the Company) within thirty days from the date of this notice, i.e., latest by 13.05.2023 to facilitate them to take steps for effective participation of public shareholders in the Delisting Offer.

We would also like to bring to the notice of the public shareholders that the Securities and Exchange Board of India vide its circular no. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/144 dated July 31, 2020 has clarified that shareholders holding equity shares in physical form are now also allowed to tender their equity shares in the Delisting Offer. Otherwise, public shareholders holding their shares in physical mode will not be able to transfer them unless they get their shares dematerialized.

Shareholders are also requested to kindly refer to SEBI Circular SEBI/HO/MIRSD/MIRSD-PoD-1/P/CIR/2023/ 37 dated March 16, 2023 towards the common and simplified norms for processing investor's service request by RTAs and norms for furnishing PAN, KYC details and Nomination.

The shareholders can contact the below mentioned personnel for their queries:

Tosha International Limited

Akshat (Company Secretary & Compliance Officer) Tel No.: +91 9266673204/05/06, +91-11-42670495 Email Id: toshainternational@yahoo.com;

Skyline Financial Services Private Limited

(Mr. Anuj Kumar)

Tel No.: 011-26812682-83, 40450193 to 97 Email id: ipo@skylinert.com;

For Tosha International Limited

Akshat

Company Secretary

Mem No.: A45376

Date: 13.04.2023

Date: 13th April 2023

Place: Pune

Place: New Delhi

SUZLON

Suzlon Energy Limited

Registered Office: "Suzion", 5, Shrimali Society, Near Shri Krishna Complex, Navrangpura, Ahmedabad - 380 009, Gujarat, India; Tel: +91 79 6604 5000; Corporate Office: One Earth, Hadapsar, Pune - 411 028, Maharashtra, India Tel: +91 20 6702 2000, Contact Person: Geetanjali S. Vaidya, Company Secretary and Compliance Officer E-mail: investors@suzlon.com; Website: www.suzlon.com; Corporate Identity Number: L40100GJ1995PLC025447

This is only an Advertisement for the information purpose and not for publication, distribution, or release, directly or indirectly, in the United States of America or otherwise outside India. This is not an offer document. All capitalised terms used and not defined herein shall have the meaning assigned to them in the Letter of Offer dated 28th September 2022 read with addendum dated 10" October 2022 filed with BSE Limited ('BSE') and the National Stock Exchange of India Limited ('NSE'), the stock exchanges where the Equity Shares of the Company are presently listed (BSE and NSE hereinafter together referred to as the "Stock Exchanges") and Securities and Exchange Board of India ('SEBI').

FIRST REMINDER-CUM-FORFEITURE NOTICE TO THE HOLDERS OF PARTLY PAID-UP EQUITY SHARES ON WHICH CALL MONEY IS TO BE PAID (ISIN :IN9040H01011)

In terms of provisions of the Companies Act, 2013 ('Act'), read with the relevant rules made thereunder, the First and Final Call Notice has been issued to such persons who were members of the Company on 2nd March 2023, being the Record Date. The call payment period has since expired on 23rd March 2023.

In this connection, the Securities Issue Committee of the Board of Directors of the Company (the "Committee"), duly authorised by the Board of Directors of the Company, at its meeting held on 29th March 2023, approved sending Reminder-cum-Forfeiture Notice from time to time for payment of the First and Final Call amount of ₹2.50 per partly-up equity share (comprising ₹1.00 towards face value and ₹1.50 towards securities premium) ("Reminder-cum-Forfeiture Notice"), to the holders of such partly paid-up equity shares on which the First and Final Call Money remains unpaid for payment of such unpaid First and Final Call along with interest @ 8% p.a., from 24" March 2023 till date of actual payment of the First and Final Call.

Accordingly, sending of First Reminder-cum-Forfeiture Notice to all the members who have not

paid the call money has been initiated on 13" April 2023. The payment period is from Saturday, 15th April 2023 to Saturday, 29th April 2023 (both days

inclusive). Payment is to be made as under: a) By net-banking / UPI through the R-WAP portal: https://rights.kfintech.com/callmoney. Kindly note that the interest amount is pre-computed when you make payment through the R-WAP

b) By demand draft made payable to "Suzlon Energy Limited – Right Allotment Account"

Please note that, failure to pay the First and Final Call Money, as aforesaid, shall render the partly paid-up equity shares of the Company, including the amount already paid thereon, liable to be forfeited in accordance with the provisions of the Act, the Articles of Association of the Company and the Letter of Offer. Further, interest @8.00% (Eight percent only) p.a. will continue to be charged for delay in payment of the First and Final Call from 24" March 2023 till date of actual payment of the First and Final Call. The Company shall be entitled to deduct from any dividend payable to such members, if any, all sums of money outstanding on account of calls and interest due thereon in relation to the partly paid-up equity shares of the Company.

All correspondence in this regard may be addressed to: KFin Technologies Limited, Unit: Suzlon Energy Limited, Selenium Tower B, Plot No. 31 and 32, Financial District, Nanakramguda, Rangareddi - 500032, Telangana, India; Contact person: Mr. M. Murali Krishna Tel: +91 40 6716 2222; Toll Free No. 1800 309 4001 (operational from Monday to Saturday between 9 a.m. and 5 p.m.) E-mail id: einward.ris@kfintech.com.

For Suzlon Energy Limited

Sd/-

Geetanjali S. Vaidya Company Secretary

www.readwhere.com

(कॉर्पोरेट व्यक्तियों के लिए दिवाला समाधान प्रक्रिया) विनियम, 2016)

कब्जा-नाटिस

विशेष रूप से ऋणीध् गारंटरों और आम जनता को एतद्दवारा आगाह किया जाता है कि उक्त संपत्तियों के साथ सौदा उप–धारा (८) के प्रावधानों के तहत ऋणकर्ता का ध्यान आकर्षित किया जाता है।

राजस्थान — 305814, फोन नं. 8769287957

मांग नोटिस की राशिः रु.7,06,976 / – (रुपये सात लाख छह हजार नौ सौ छिहत्तर मात्र)

राजस्थान — 341509., फोन नं. 9571423169

कब्जे की तिथिः 11 अप्रैल. 2023

दिनांक : 14/04/2023, स्थान : राजस्थान

U GRO यू ग्रो कैपिटल लिमिटेड

प्रातभुत आस्तियों का विवरण:

Place: Lucknow





પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતમાં કૃષિ ક્ષેત્રે રવિ પાકની લણણીની સીઝનના ૧૩ અથવા ૧૪ એપ્રિલ બૈશાખીના તહેવાર તરીકે પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. તસ્વીરમાં જમ્મુ-કાશ્મીરના જમ્મુ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઘઉંના પાક ઉભેલા એક ખેતરમાં સ્કૂલની શિક્ષિકાઓ વિદ્યાર્થીઓ બેશાખીની ઉજવણી દરમિયાન નૃત્ય કરી રહેલી નજરે પડે છે.

સંક્રમણ હજુ ૧૦-૧૨ દિવસ વધરો : લોકોને ફરી માસ્ક પહેરવાની સલાહ



કોરોનાના દૈનિક કેસોમાં ચિંતાજનક વૃધ્ધિ વચ્ચે . વિભાગના અધિકારીઓએ એવો નિર્દેશ કર્યો છે કે સંક્રમણમાં હજુ ૧૦-૧૨ દિવસ વધારો થવાની શકયતા છે. પોઝીટીવ કેસો વધવા છતાં સ્થિતિ ગંભીર નથી કારણ કે

હોસ્પીટલાઇઝેશન ઘણું ઓછું છે. વર્તમાન કેસો સામાન્ય ફલુ જેવા જણાય રહ્યા છે અને તે કાયમી ધોરણે હોય જ છે. એટલું જ નહીં અમુક ક્ષેત્રોમાં જ હોવાથી તાત્કાલીક નિયંત્રણમાં આવી શકે છે. નિષ્ણાંતોએ એવી પણ સલાહ આપી છે કે સાવચેતીરૂપે ફરી માસ્કનો ઉપયોગ શરૂ કરવો જોઇએ. ખાસ કરીને અન્ય રોગ ધરાવતા લોકો તથા વૃઘ્ધોની પણ ખાસ સારસંભાળ રાખવી જોઇએ. હરિયાણા, કેરળ તથા પુડુચેરીએ માસ્ક ફરજીયાત કર્યાનું ઉદ્ઘેખનીય છે.

કોવિશિલ્ડ રીટર્નઃ ફરી ઉત્પાદન શરૂ કરતી સીરમ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની વધુ એક હલકી લહેર આવી રહી હોવાના સંકેત છે અને તે સમયે બે ડોઝ બાદના બુસ્ટર ડોઝ તથા આરોગ્ય સહિતના હાઈ-રીસ્ક કેટેગરીમાં આવતા કર્મચારીઓને જરૂર પડે ચોથો ડોઝ આપવાની આવશ્યકતા રહેશે તેવા અંદાજ બાદ દેશમાં સૌથી વધુ ભરોસાપાત્ર સાબીત થયેલી 'કોવિશિલ્ડ' વેકસીનનું ઉત્પાદન ફરી શરૂ કરવા પુના સ્થિત સીરમ ઈન્સ્ટીટયુટ દ્વારા નિર્ણય લેવાયો છે. જો કે હવે સરકાર ફ્રીમાં વેકસીન આપે તેવી શકયતા નહીવત છે તેથી સીરમે દેશની હોસ્પીટલો તથા રાજય સરકારોના એડવાન્સ ઓર્ડરના આધારે જ વેકસીન ઉત્પાદન કરવા અને

તે પેઈડ હશે તે નિશ્ચિત કરશે.

યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ માટે રાહત, ભારતમાંથી જ મુખ્ય પરીક્ષા આપી શકરો

મેડિકલ એજ્યુકેશન: રશિયા સાથે ઝાપારોવાએ નવી દિલ્હીની તેમની જાહેરાત કરવામાં આવી છે.

આ માહિતી યક્રેનના પ્રથમ

ન્યુ દિલ્હી,તા.૧૩ નાયબ વિદેશ મંત્રી એમિન **પશ્ચિમ યુક્રેન ગયા હતા** :

યદ્ધ શરૂ થયા બાદ યુક્રેનમાંથી જીવ ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન રશિયન આક્રમણ શરૂ થયું ત્યારે બચાવીને સ્વદેશ પરત ફરેલા ભારતીય ભારતીય મંત્રીને આપી હતી. આ લગભગ ૧૯,૦૦૦ ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ માટે રાહતના પછી, ભારતીય વિદેશ મંત્રાલય વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરી સમાચાર છે. યુદ્ધ દરમિયાન (MEA) એ બુધવારે કહ્યું કે રહ્યા હતા. અંદાજ મુજબ, લગભગ ઓપરેશન ગંગા હેઠળ ભારત પરત ભારતીય તબીબી વિદ્યાર્થીઓના મુદ્દા ૨,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેન ફરેલા વિદ્યાર્થીઓને તેમની મુખ્ય પર, યુક્રેનના નાયબ વિદેશ મંત્રીએ પાછા ગયા છે અને તેઓ મોટાભાગે પરીક્ષા આપવા માટે યુક્રેન જવાની ઉક્ષેખ કર્યો કે યુક્રેન વિદેશી તબીબી પૂર્વી યુરોપિયન દેશના પશ્ચિમ જરૂર રહેશે નહીં. આવા ભારતીય વિદ્યાર્થીઓને તેમના દેશમાં યુનિફાઇડ ભાગમાં રહે છે. યુક્રે નિયન વિદ્યાર્થીઓ અહીં રહીને જ યુક્રેનિયન સ્ટેટ ક્વોલિફિકેશન પરીક્ષા આપવાની સત્તાવાળાઓની પહેલ હેઠળ, જે યુનિવર્સિટીઓની મુખ્ય પરીક્ષાઓમાં મંજૂરી આપશે. ઝાપરોવાની ભારત વિદ્યાર્થીઓ હજુ પણ ભારતમાં છે બેસી શકશે. યુક્રેન સરકાર દ્વારા મુલાકાતના સમાપન પર વિદેશ તેઓ ઓનલાઈન ક્લાસમાં જોડાઈ ભારતીય વિદ્યાર્થીઓને ભારતમાંથી જ મંત્રાલય તરફથી એક નિવેદન જારી શકે છે અને ભારતમાં યુનિફાઈડ સ્ટેટ મખ્ય પરીક્ષા આપવા દેવાની સત્તાવાર કરીને આ માહિતી આપવામાં આવી એ લિજિ બિલિટી ટેસ્ટ

બે હજાર વિદ્યાર્થીઓ કરીથી વિકલ્પ ધરાવે છે.

રાહુલ ગાંધી પર નવી મુશ્કેલી, વિનાયક સાવરકર

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે (USQE)માં ભાગ લેવાનો

પર નિવેદન બદલ માનહાનિની ફરિયાદ દાખલ નવી દિલ્હી,તા.૧૩ ટિપ્પણી કરી હતી કે વીર સાવરકરે કર્યા પછી, મહારાષ્ટ્ર વિકાસ અઘાડી

વિચારસરણી વિનાયક દામોદર અને વીર સાવરકરને મજા આવી સક્રિય થવું પડ્યું હતું. સાવરકરની સાવરકરના ભાઈના પૌત્ર સાત્યકી હતી. આ ટિપ્પણી તેમનું અપમાન કોંગ્રેસ નેતા દ્વારા થયેલ ટીકાએ સાવરકરે હવે રાહુલ ગાંધી વિરૂદ્ધ છે કારણ કે આ સમગ્ર ઘટના મહારાષ્ટ્રમાં તેના સહયોગી

ગયા મહિને ઈંગ્લેન્ડ ગયા હતા આરોપ લગાવી રહ્યા છે. અને એક મીટિંગમાં તેમણે તાજેતરમાં, વીડી સાવરકરની ટીકા

મશ્કેલી ખતમ થવાનું નામ નથી તેમના ૫-૬ મિત્રો સાથે મળીને ઘટાડવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ લઈ રહી. સ્વર્ગસ્થ હિંદુવાદી એક મુસ્લિમ વ્યક્તિને મારતા હતા (એનસીપી) ના વડા શરદ પવારને ફોજદારી માનહાનિની ફરિયાદ કાલ્પનિક છે. રાહુલ ગાંધી સાવરકર એનસીપી અને શિવસેના વચ્ચે પર જેલમાંથી બહાર આવવા બેચેની જેવી સ્થિતિ પેદા કરી તેમને કહ્યું, ''રાહુલ ગાંધી અંગ્રેજોની 'માફી' માગવાનો _{હતી.}

ગરમીનો પ્રકોપ શરૂ : છ રાજયોમા તાપમાન ૪૦ ડીગ્રીને

હવામાનમાં અસામાન્ય બદલાવ વટાવી જવાની આગાહી કરવામાં

તથા વારંવાર માવઠા-કમોસમી વરસાદની સ્થિતિ વચ્ચે ઉનાળાની ગરમીનો કોપ શરૂ થઇ ગયો હોય તેમ

અર્ધો ડઝન રાજયોમાં તાપમાનનો પણ સામાન્ય કરતા બે થી ત્રણ પારો ૪૦ ડિગ્રીને પાર કરીને ૪૨ ડિગ્રી વધુ છે. ડિગ્રી સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગના રીપોર્ટ પ્રમાણે મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિસા તથા તેલંગણામાં તાપમાનનો પારો ૪૦થી ૪૨ ડિગ્રી નોંધાયો છે. આવતા દિવસોમાં

નવી દિલ્હી, તા. ૧૩ સુર્યનો પ્રકોપ વધશે પાટનગર દેશમાં છેલા બે મહિનાથી દિલ્હીમાં પણ પારો ૪૦ ડિગ્રીને

આવી છે. અમુક ક્ષેત્રોમાં જમ્મુ-કાશ્મીર, પૂર્વ ભારત તથા પારો ૪૨ ડિગ્રીએ પૂર્વોતર રાજયો પહોંચી ગયો આંધ્રપ્રદેશમાં તાપમાનનો પારો

બીજી તરફ ગોવા, કોંકણ,

મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, લડાખ, હિમાચલપ્રદેશ તથા ઉતરાખંડમાં ગાજવીજ અને વિજળી સાથે વરસાદ થવાની પણ આગાહી કરવામાં વી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તેમના પુસ્તકમાં લખ્યું છે કે તેઓ ગઠબંધનમાં તણાવ હતો, જેને

જાહેર નોટીસ

આથી જાહેર જનતાને જણાવવાનું કે મોજે વસાપુર, અમદાવાદ ફાઈનલ પ્લોટ નંબર 30, ટીપી સ્કીમ નંબર ૧ માં આવેલ ધવલ કો. ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લિમિટેડ જે માનસી કોમ્પલેક્ષ ના નામે ઓળખાય છે. સદર સોસાયટી ના એ બ્લોક ન બીજા માળે આવેલ ફ્લેટ નંબર ૨૦૪ નું ઓરિજિનલ શેર સર્ટિફિકેટ નંબર ૭૧, તા.૧૩–૧૧–૧૯૯૫ ના ૨ો૧ સંદીપ પ્રાણનાથ ભાટીયા ના નામનું ઈસ્યુ થયેલ હતું. અમો સંદીપ પ્રાણનાથ ભાટીયા એ ફ્લેંટ નંબર ૨૦૪ એ બ્લોક માં બીજા માળે સોસાયટી ના ऒऒ॔नार्धपर सुनिता इन्स्ट्रङशन પાસેથી વેચાણ રાખેલ, પરંતુ હાલમાં सहर इतेट नुं ओरिषिनंत शेर સર્ટિફિકેટ નંબર ૭૧ ખોવાઈ ગયેલ છે. જે કોઈને મળે તો નીચે જણાવેલ सरनामे परत हरवा विनंती छे. आ જાહેરાત સોસાયટી માંથી ડુપ્લિકેટ શેર સર્ટિફિકેટ મેળવવા માટે આપીએ છીયે. આ જાહેરાત ની તારીખ થી ૨૧ દિવસ પછી સોસાયટી માં ડુપ્લિકેટ શેર સર્ટિફિકેટ મેળવવા ની કાર્યવાહી કરવામાં આવશે જેની જાહેર જનતા એ નોંધ લેવી.

લી. રોમી પ્રાણનાથ ભાટીયા પાવર ઓફ એટર્ની હોલ્ડર ઓફ ક્બજેદાર સંદીપ પ્રાણનાથ ભાટીયા દાવલ કો-ઓપ હાઉસીંગ સોસાયટી લી. માનસી કોમ્પ્લેક્ષ, ફ્લેટ નંબર ૨૦૪ એ-બ્લોક વસાપુર,અમદાવાદ-૩૮૦૦૧૫. મો.: ૯૮૭૯૨ ૦૦૭૨૨

હું મારી જાતને સતત વિદ્યાર્થી માનું છું અને દરેક સમયે શિખવાની તૈયારી છે : યુવાનોને વડાપ્રધાનની સલાહ

ોના અંત સધીમાં ૧૦ લાખ રોજગારનો લક્ષ્યાં

દેશમાં રેલવે, ગૃહ, મહેસુલ તથા સંરક્ષણ સહિતના ક્ષેત્રમાં સરકાર સતત નવી

વિશ્વમાં સૌથી ઝડપી વિસ્તરી રહ્યું છે અનેક દેશો જયારે આર્થિક રીતે ભાંગી પડયા તો આજે ભારત મજબુતીથી ઉભુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશભરમાં ૭૧

ઇન્સ્ટિટ્યૂટ એ આંધ્ર પ્રદેશના

પૃથ્વી તત્વોની હાજરી શોધી કાઢી

છે, જે ઘણા ઇલેક્ટ્રોનિક ઉપકરણો,

ખનિજોમાં લેન્થેનમ, સેરિયમ,

બોરોઅર/કાયદેસરનાં

વારસદાર(રો) અને કાયદેસરના

પ્રતિનિધિ(ઓ)નાં નામ

શ્રી અશ્વિનભાઇ ડાહ્યાભાઇ પટેલ

(બી)

(બોરોઅર)

તારીખ : ૧૩-૦૪-૨૦૨૩

શ્રીમતી ગીતાલેન ર

પટેલ (કો-બોરોઅર)

નવી દિલ્હી, તા. ૧૩ લક્ષ્યાંક ઘરાવે છે. મોદીએ કહ્યું કે એવું છે કે જયાં સીધી અને આડકતરી રહી છે. મોદીએ અનેક ક્ષેત્રનો ઉદ્ઘેખ દેશમાં કોરોના કાળ બાદ અર્થતંત્ર ભારતમાં સ્ટાર્ટઅપ કલ્ચર એ સૌથી બંને રોજગારી ઉપલબ્ધ છે અને કરતા કહ્યું કે આજના યુવાનોએ

રોજગારી ઉપલબ્ધ બનાવી રહી છે : વધુ ૭૧ હજાર લોકોને રોજગારી હેત્ વર્ચ્યુઅલ સંબોધન મારફત એપોઇન્ટમેન્ટ પત્ર એનાયત કરતા વડાપ્રધાન હજારથી વધુ યુવાનનો રોજગારી મહત્વનું સાબિત થઇ રહ્યું છે ખાસ દેશમાં ૮-૯ વર્ષમાં ૨મત ગમત હંમેશા શિખવા માટે તૈયાર રહેવું

ભારતને મળ્યો અમુલ્ય ખજાનો

આંધ્રના અનંતપુરમાં હળવા દુર્લભ

પૃથ્વી તત્વોની હાજરી શોધી કઢાઇ

NGRI માં વરિષ્ઠ પ્રિન્સિપાલ

રાજુએ જણાવ્યું હતું કે, "અમને

સમગ્ર ખડકોના વિશ્લેષણમાં પ્રકાશ

એપ્લિકેશનો માટે મહત્વપૂર્ણ ઘટક મળી છે, જે પુષ્ટિ કરે છે કે આ ફોન, ટેલિવિઝન, કોમ્પ્યુટર,

મોબાઈલ ફોન સહિત જે

હાઉસિંગ ડેવલપમેન્ટ ફાચનાન્સ કોર્પોરેશન લિ.

એચડીએફ્સી હાઉસ, મીઠાખળી છ રસ્તા પાસે, નવરંગપુરા,

અમદાવાદ. ફોન : (૦૯૯) ૬૬૩૦७०००

પઝેશન તારીખ

સિમ્બોલીક

(8)

૧૨ એપ્રિલ,

5053

ടിന്റെങ

<mark>લાઉસિંગ કેવલપમેન્ટ કાચનાન્સ કોર્પોરેશન લિમિટેકના</mark> અધિકૃત અધિકારીઓને સિક્યોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ કલમ ૧૩(૧૨), સિક્યોરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ના રૂલ ૩ સાથે વાંચતા મળેલ સત્તાને આધિન રહી ઉપરોક્ત એક્ટની કલમ ૧૩(૨) હેઠળ નીચેના બોરોઅર/કાયદેસરના વારસ(સો) અને કાયદેસરના પ્રતિનિધિ(ઓ)ને ડિમાન્ડ નોટિસ પાઠવવામાં આવેલ, જે અનુસાર તેમના જે તે નામ સામે દર્શાવેલ રકમ સહિત નોટિસમાં દર્શાવાયેલ તે ૨કમ ઉપરનું વ્યાજ, નોટિસ તારીખથી ૯૦ દિવસમાં ચૂકવી આપવા જણાવાયેલ છે. જે મુજબ પ્રાસંચિક ખર્ચા,

ડિમાન્ડ

નોટિસ

(31)

જો કે, અહીં ઉપર દર્શાવેલ બોરોઅર/કાયદેસરના વારસો અને કાયદેસરના પ્રતિનિધિ(ઓ) બાકી લેશી નીકળતી રકમ ચૂકવવામાં નિષ્કળ ગયેલ છે, તેથી આ સાથે ઉપરોક્ત બોરોઅર/કાયદેસરના વારસ(સો) અને કાયદેસરના પ્રતિનિધિ(ઓ)ને વ્યક્તિગત રીતે અને જાહેર જનતાને સૂચના આપવામાં આવે છે કે, **એચકીએફસી**ના અધિકૃત અધિકારી દારા ઉપરોક્ત એક્ટની કલમ ૧૩ (૪) હેઠળ અને ઉપરોક્ત નિયમના નિયમ ૮ સાથે વાંચતા મળેલ સત્તાને આધિન રહી, ઉપરોક્ત તારીખોએ અહીં ઉપર દર્શાવેલ સ્થાયી પ્રોપર્ટી/સિક્યોર્ડ એસેટનો **કળનો** મેળવી લેવામાં આવેલ છે. અહીં ઉપરોક્ત બોરોઅર/કાયદેસર વારસો અને કાયદેસરના પ્રતિનિધિ(ઓ)ને વ્યક્તિગત રીતે અને જાહેર જનતાને આ સાથે સાવધાન કરવામાં આવે છે કે ઉપરોક્ત

સ્થાયી પ્રોપરિપિસ્પાર્ડ એસે દ સાથેનો કોઈ સોદો કરાશે તો તે **હાઇસિંગ કેવલમમેન્ટ ફાયાનાન્ય કોપિરિસન** (શિકેટના ગિરો હક્કને આવિન રહેશે. બોરોઅર(સે) / ક્રાયદેસરના વારસ (દારો) / ક્રાયદેસરના પ્રતિનિધિ(ઓ)નું ધ્યાન દોરવામાં આવે છે કે એક્ટની કલમ-૧૩ ની પેટા કલમ (૮) ની જોગવાઈઓ અનુસાર

સમય રહેતાં પોતાની સલામત અસ્કયમાત/તો છોડાવી લે. કરવામાં આવેલ પંચનામું અને તૈયાર કરાયેલ ઈ-વેન્ટરી નીચે સહી કરનાર પાસે ઉપલબ્ધ છે; અને ઉપરોક્ત બોરોઅર(સે) / કાયદેસરના વારસ (દારો)/ કાયદેસરના પ્રતિનિષિ(ઓ)ને વિનંતી છે કે જે તે નકલ નીચે સહી કરનાર પાસેથી કાયકાજના દિવસોએ કામકાજના સમય દરમિયાન મેળવી લે.

નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ સ્કેન્ડિયમનો સમાવેશ થાય છે.

અનંતપુર જિલ્લામાં હળવા દુર્લભ સાયન્ટિસ્ટ, ડૉ. પી.વી. સુંદર

તબીબીટેક્નોલોજી, એરોસ્પેસ અને દુર્લભ તત્વો (La, Ce, Pr, Nd,

સંરક્ષણ સહિત વિવિધ ઔદ્યોગિક Y, Nb અને Ta) ની નોંધપાત્ર માત્રા

પ્રાસો ડીયમ, નિયો ડીમિયમ, ડિવાઇસનો આપશે દરરોજ ઉપયોગ

યટ્રીયમ, હેફનીયમ, ટેન્ટેલમ, કરીએ છીએ તેમાં અને તબીબી

તારીખના રોજ

બાકી લેશાં* રૂ.

(સી)

લાગુ પડતા વધારાના વ્યાજ સાથે, પ્રાસંગિક ખર્ચા, અન્ય ખર્ચા, ચાર્જિસ વગેરે ચૂકવજ્ઞી/જમા થાય ત્યાં સુધીના ગજ્ઞારો

₹I. €€,¥9,63८/-

છે. હળવા દુર્લભ પૃથ્વીના ખનિજોમાં REE છે.

સંરક્ષણ સહિતની વિવિધ ઔદ્યોગિક

એપ્લિકેશનો માટે આરઇઇ

મહત્વપૂર્ણ ઘટકો છે.રાજુએ કહ્યું કે

REE સ્થાયી ચૂંબકના વિનિર્માણમાં

REE નો સૌથી વધુ ઉપયોગ છે.

તેમણે કહ્યું કે સ્થાયી ચૂંબક મોબાઈલ

ઓટોમોબાઈલ, પવનચક્કી, જેટ

એરકાફ્ટ અને અન્ય ઘણા

ઉત્પાદનોમાં વપરાતા આધુનિક

ઈલેક્ટ્રોનિક્સ માટે મહત્વપૂર્ણ છે.

સ્થાવર મિલકત(તો) / સલામત

(એફ)

બંગ્લો-૧૯, પંચામૃત બંગ્લોસ, પ્લોટ ૫७ અને ૫૯,

રે. સ. નં. ૪૦૯/૧ + ૨, ૪૧૦, ૪૧૧, ટીપીએસ-૪૨,

એફપી-૫૦ + ૫૯, ઓફ-સાયન્સ સિટી રોડ, સીમ્સ

હોસ્પિટલ સામે, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦.

વતી, હાઉસિંગ ડેવલપમેન્ટ કાચનાન્સ કોર્પોરેશન લિ

અદ્યકૃત અદ્યકારી

અસ્કયામત(તો) નું વર્શન

એપોઇન્ટમેન્ટ લેટર આપતા વર્ચ્યુલ કરીને ૧૦ વર્ષ પહેલા યુવાનોને જે ક્ષેત્રનો કાયાકલ્પ થયો છે અને આજે જોઇએ મોદીએ પોતાનું દ્રષ્ટાંત સંબોધનમાં જણાવ્યું કે ચાલુ વર્ષના તક ઉપલબ્ધ ન હતી તે તક મળી આત્મનિર્ભર ભારત હેઠળ વોકલ ફોર આપતા જણાવ્યું કે મારી જાતને અંત સુધીમાં રેલવે, ગૃહ, રેવન્યુ તથા રહી છે અને સ્ટાર્ટઅપ મારફત ૪૦ લોકલનું મહત્વ વધ્યું છે અને અત્યંત એક વિદ્યાર્થી જ માનુ છું કદી પણ સંરક્ષણ સહિતના વિભાગોમાં ૧૦ લાખથી વધુ લોકોને રોજગારી મળી આધુનિક ઉપગ્રહો તથા સેમી એ વિચારતો નથી કે મને બધુ આવડે લાખ લોકોને રોજગારી આપવા માટે છે તેવી જ રીતે ડ્રોન સેકટર પણ હાઇસ્પીડ ટ્રેનો ભારતમાં નિર્મિત થઇ

નથી અને તમારે પણ અભિગમ રાખવો જોઇએ. મોદીએ કહ્યું કે આજે સંરક્ષણ ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બની ગયું છે જેની કદી કલ્પના ન હતી. રોજગારના સર્જન માટે સતત ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનું નિર્માણ થઇ

સરકાર મોટા પાયે માર્ગ, બંદર, રેલવે સહિતની સુવિધાઓ વધારી રહી છે અને તેના કારણે રોજગારને સતત બળ મળે છે.

KALPA-TARU

POWER TRANSMISSION LIMITED

કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશન લિમિટેડ

રજિ. ઓફિસઃ પ્લોટ નં.૧૦૧, પાર્ટ-III, જીઆઇડીસી એસ્ટેટ, સેક્ટર - ૨૮, ગાંધીનગર - ૩૮૨ ૦૨૮, ગુજરાત, ભારત टेबि..: +८१ ७८ २३२ १४००० ई**५**स: +८१ ७८ २३२ ११८६६ ઇમેઇલઃ c<u>s@kalpatarupower.com</u> વેબઃ www.kalpatarupower.com CIN: L40100GJ1981PLC004281

પોસ્ટલ બેલેટ નોટિસ

કંપનીના સભ્યોને આથી કંપનીધારા, ૨૦૧૩ (કાયદો)ના સેક્શન ૧૧૦ અને અન્ય લાગુ પડતી જોગવાઈઓને -જો કોઈ હોય તો- કંપનીઝ (મેનેજમેન્ટ અને વહીવટ) નિયમો, ૨૦૧૪, (નિયમો) સાથે,સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્રસ) નિયમન ૨૦૧૫ (સેબી લિસ્ટિંગ રેગ્યુલેશન્સ)ના નિયમન નં. ૪૪ ને

સામાન્ય સર્ક્યુલરો નં. ૧૪/૨૦૨૦ તા.૦૮મી એપ્રિલ,૨૦૨૦, નં. ૧૭/ ૨૦૨૦તા.૧૩મીએપ્રિલ,૨૦૨૦, નં. ૧૦/૨૦૨૧ તા. ૨૩મી જૂન ૨૦૨૧, નં. ૨૦/૨૦૨૧ તા.૦૮મી ડિસેમ્બર, ૨૦૨૧, નં.૦૩/૨૦૨૨ તા.૦૫મી મે, ૨૦૨૨, નં.૧૧/૨૦૨૨ તા. ૨૮મી ડિસેમ્બર, ૨૦૨૨ સાથે વંચાણે લીધા અનુસાર, અને કોર્પોરેટ અફેર્સ મંત્રાલયએ ઇસ્યૂ કરેલ અન્ય લાગુપડતા રેગ્યુલેશન્સ અને સર્ક્યુલરો (હવે પછી એમસીએ સર્ક્યુલર્સ તરીકે ઉલ્લેખાશે) . ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરેલ સામાન્ય સભા અંગે સેક્રેટરીયલ સ્ટાન્ડર્ડ ('એસએસ-૨') અને અન્ય લાગુ પડતા કાયદાઓ અને નિયમનો (જે તે સમયે લાગુ એવા કોઈ સ્ટેચ્યુટરી સુધારાઓ અથવા રિ-એનેક્ટમેન્ટ થયા હોય તે સહિત) પોસ્ટલ બેલેટ નોટિસમાં ઠરાવ્યા મુજબ સ્પેશિયલ બિઝનેસ, તે કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશન લિમિટેડ(કંપની)ના સભ્યો દ્વારા માત્ર રિમોટ ઈ-વોટિંગની (ઈ-વોટિંગ) પ્રક્રિયા દ્વારા પોસ્ટલ બેલેટ પ્રક્રિયાથી પસાર થવા જોઈએ તે માટે પ્રસ્તાવ મૂકવામાં આવેલ છે.

નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (એનએસડીએલ) અને સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીઝ(ઇન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ) પાસેથી મંગળવાર,૧૧મી એપ્રિલ, ૨૦૨૩ (કટ ઓફ તારીખ) મુજબ મળેલ કંપનીના સભ્યોના રજિસ્ટરમાં/લાભાર્થી માલિકોની યાદીમાં જે સભ્યોના નામ છે અને જે સભ્યોના ઈમેઇલ સરનામાં કંપની પાસે ∕િડપોઝીટરીઝ પાસે રજિસ્ટર કરેલા છે તેમને પોસ્ટલ બેલેટ નોટિસ (નોટિસ)ની ઇલેક્ટ્રોનિક કોપીઓ સમજૂતિ નિવેદન સાથે ગુરુવાર, ૧૩મી એપ્રિલ, ૨૦૨૩ના રોજરવાના કરી દીધેલછે. એમસીએ સર્ક્યુલર્સની જોગવાઈ મુજબ મળેલ રાહતથી પોસ્ટલ બેલેટ નોટીસની ભૌતિકરૂપે કોપીઓ પોસ્ટલ બેલેટ ફોર્મ્સ સાથે અને પ્રિપેઈડ બિઝનેસ રિપ્લાય એનવેલપ સાથે આ પોસ્ટલ બેલેટ માટે સભ્યોને મોકલવામાં આવ્યા નથી પોસ્ટલ બેલેટ નોટિસમાં જણાવેલ દસ્તાવેજો નિરીક્ષણ માટે ઉપલબ્ધ છે અને જે સભ્યો જોવા માગતા હોય તેમણે cs@kalpatarupower.com ને ઈમેઈલ

નોટિસ કંપનીની વેબસાઇટ www.kalpatarupower.com અને શેરબજારો બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ પર અનુક્રમે <u>www.bseindia.com</u> અને <mark>www.nseindia.com</mark> તથા ડીપોઝીટરી એટલે કે સીડીએસએલની વેબસાઇટ એટલે કે <u>www.evotingindia.com</u> પર

એમસીએ સર્ક્યુલર્સ અનુસાર, જે સભ્યોના ઈમેઇલ સરનામાં રજિસ્ટર નથી થયેલ અને પરિણામે પોસ્ટલ બેલેટ નોટિસ નથી મેળવી શક્યા તેઓ કામચલાઉપણે તેમના ઈ-મેઇલ કંપનીના આરટીએ, લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને ahmedabad@linkintime.co.in પર મોકલીને રજિસ્ટર કરાવવા વિનંતી છે. ઈ-મેઇલના સફળ રજિસ્ટ્રેશન પછી સભ્યોને નોટિસની સોફ્ટ કોપી મળી શકે છે અને ઈ-વોટિંગની પ્રક્રિયા માટે આ પોસ્ટલ બેલેટ માટે વોટિંગ કરી શકશે. કોઈ પણ સમસ્યા માટે સભ્યો <u>ahmedabad@linkintime.co.in</u> ને

કંપની સભ્યોને તેમનો ઈલેક્ટ્રિક સાધન વડે મત આપવાનો અધિકાર પ્રયોગ કરવાની સુવિધા સીડીએસએલ (સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીઝ (ઇન્ડિયા) લિમિટેડ) દ્વારા ઈ-વોટિંગ સેવાઓ પૂરી પાડીને આપે છે. ઈ-વોટિંગ માટેની વિગતવાર સચનાઓ નોટિસમાં પુરી પાડેલ છે.

રિમોટ ઈ-વોટિંગ સુવિધા નીચેના સમયગાળા માટે ઉપલબ્ધ છેઃ

ઈ-વોટિંગની શરૂઆત |શનિવાર, ૧૫મી એપ્રિલ, ૨૦૨૩ સવારે ૦૯:૦૦ (ભારતીય સમય) વાગે ઈ-વોટિંગની સમાપ્તિ રવિવાર, ૧૪મી મે, ૨૦૨૩ સાંજે ૦૫:૦૦ (ભારતીય સમય) વાગે

રિમોટ ઈ-વોટિંગ મોડ્યુલ તે પછી સીડીએસએલ દ્વારા બંધ થઈ જશે અને ઉપરની તારીખ અને સમય પછી ઈ-વોટિંગ કરવાની છૂટ નહીં રહે.

આ સમયગાળા દરમિયાન ફિઝિકલ મોડ કે ડિમટિરિયલાઇઝ્ડ મોડમાં શેર ધરાવતા સભ્યો મંગળવાર,૧૧મી એપ્રિલ, ૨૦૨૩ (કટઓફ તારીખ)ના રોજ તેમનો મત ઈ-વોટિંગથી આપી શકશે. સભ્યે એક વાર ઠરાવ પર મત આપ્યો તે પછી તેમાં સુધારાની પછીથી છટ નહીં મળે. સભ્યોના મતાધિકાર કટઓફ તારીખે કંપનીના તેમના પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલ ના પ્રમાણ મુજબ રહેશે. જે વ્યક્તિ કટઓફ તારીખે સભ્ય નથી એમણે આ નોટિસ કેવળ જાણકારીના હેતુથી સમજવી.

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શ્રી ઉર્મિલ વેદ, ગાંધીનગર (FCS: 8094, COP: 2521) પ્રેક્ટિસીંગ કંપની સેક્રેટરીની ઈ-વોટિંગ પ્રક્રિયા દ્વારા પોસ્ટલ બેલેટ ફેર અને પારદર્શક રીતે સંચાલિત કરવા માટે સ્ક્રૂટિનાઇઝર તરીકે

સ્ક્રૂટિનાઇઝર તેમનો રિપોર્ટ ચેરમન ને અથવા કંપનીના કોઈ અધિકૃત વ્યક્તિને સોંપશે તથા પોસ્ટલ બેલેટના પરિણામો ૧૬મી મે, ૨૦૨૩ના રોજ કે તે પહેલાં જાહેર થશે. સદર પરિણામો કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે દર્શાવાશે તથા નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ ઓફ ઇન્ડિયા (એનએસઈ) અને બીએસઈ લિ.(બીએસઈ)ને જાણ કરાશે કે જ્યાં કંપનીના શેર લિસ્ટેડ થાય છે. વધુમાં પરિણામો કંપનીની વેબસાઇટ <u>www.kalpatarupower.com</u> તથા સીડીએસએલની વેબસાઇટ <u>www.evotingindia.com</u> પર દર્શાવાશે.

જો તમારી કોઈ પૂછપરછ કે તકલીફ હોય તો તમે www.evotingindia.com પર હેલ્પ સેક્શન હેઠળ ઉપલબ્ધ ફ્રીકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્વન્સ-વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) સેક્શન પર અને ઈ-વોટિંગ યુઝર મેન્યુઅલ જોઈ શકો છો અથવા શ્રી રાકેશ દળવી, સીનિયર મેનેજર, સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીઝ (ઇન્ડિયા) લિમિટેડ, એ વિંગ, ૨૫મો માળ, મેરેથોન ફ્યુચરેક્સ, મફતલાલ મિલ કંપાઉન્ડ્સ, એન એમ જોશી માર્ગ, લોઅર પરેલ (ઇસ્ટ) મુંબઈ-૪૦૦૦૧૩ નો સંપર્ક કરવો. મોકલવી અથવા helpdesk.evoting@cdslindia.com ને ઈ-મેઇલ મોકલવો અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૨ ૫૫ ૩૩ ઉપ૨ ફ્રોન કરવો.

વતી, કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશન લિમિટેડ

સ્થળ :મુંબઈ શ્વેતા ગિરોત્રા તારીખ : ૧૩મી એપ્રિલ, ૨૦૨૩ કંપની સેક્રેટરી



Registered Office: "Suzlon", 5, Shrimali Society, Near Shri Krishna Complex, Navrangpura, Ahmedabad - 380 009. Gujarat, India; Tel: +91 79 6604 5000; Corporate Office: One Earth, Hadapsar, Pune - 411 028, Maharashtra, India Tel: +91 20 6702 2000, Contact Person: Geetanjali S. Vaidya, Company Secretary and Compliance Officer E-mail: investors@suzlon.com; Website: www.suzlon.com; Corporate Identity Number: L40100GJ1995PLC025447

This is only an Advertisement for the information purpose and not for publication, distribution, or release, directly or indirectly, in the United States of America or otherwise outside India. This is not an offer document. All capitalised terms used and not defined herein shall have the meaning assigned to them in the Letter of Offer dated 28th September 2022 read with addendum dated 10th October 2022 filed with BSE Limited ('BSE') and the National Stock Exchange of India Limited ('NSE'), the stock exchanges where the Equity Shares of the Company are presently listed (BSE and NSE hereinafter together referred to as the "Stock Exchanges") and Securities and Exchange

> FIRST REMINDER-CUM-FORFEITURE NOTICE TO THE HOLDERS OF PARTLY PAID-UP EQUITY SHARES ON WHICH CALL MONEY IS TO BE PAID (ISIN :IN9040H01011)

In terms of provisions of the Companies Act, 2013 ('Act'), read with the relevant rules made thereunder, the First and Final Call Notice has been issued to such persons who were members of the Company on 2nd March 2023, being the Record Date. The call payment period has since expired on 23rd March 2023.

In this connection, the Securities Issue Committee of the Board of Directors of the Company (the "Committee"), duly authorised by the Board of Directors of the Company, at its meeting held on 29th March 2023, approved sending Reminder-cum-Forfeiture Notice from time to time for payment of the First and Final Call amount of ₹2.50 per partly-up equity share (comprising ₹1.00 towards face value and ₹1.50 towards securities premium) ("Reminder-cum-Forfeiture Notice"), to the holders of such partly paid-up equity shares on which the First and Final Call Money remains unpaid for payment of such unpaid First and Final Call along with interest @ 8% p.a., from 24th March 2023 till date of actual payment of the First and Final Call.

Accordingly, sending of First Reminder-cum-Forfeiture Notice to all the members who have not paid the call money has been initiated on 13th April 2023

The payment period is from Saturday, 15th April 2023 to Saturday, 29th April 2023 (both days inclusive). Payment is to be made as under

a) By net-banking / UPI through the R-WAP portal: https://rights.kfintech.com/callmoney. Kindly note that the interest amount is pre-computed when you make payment through the R-WAF

b) By demand draft made payable to "Suzlon Energy Limited - Right Allotment Account" Please note that, failure to pay the First and Final Call Money, as aforesaid, shall render the partly paid-up equity shares of the Company, including the amount already paid thereon, liable to be forfeited in accordance with the provisions of the Act, the Articles of Association of the Company and the Letter of Offer. Further, interest @8.00% (Eight percent only) p.a. will continue to be charged for delay in payment of the First and Final Call from 24th March 2023 till date of actual payment of the First and Final Call. The Company shall be entitled to deduct from any dividend payable to such members, if any, all sums of money outstanding on account of calls and interest

All correspondence in this regard may be addressed to: KFin Technologies Limited, Unit: Suzlon Energy Limited, Selenium Tower B, Plot No. 31 and 32, Financial District, Nanakramguda, Rangareddi - 500032, Telangana, India; Contact person: Mr. M. Murali Krishna Tel: +91 40 6716 2222; Toll Free No. 1800 309 4001 (operational from Monday to Saturday between 9 a.m. and 5 p.m.) E-mail id: einward.ris@kfintech.com.

due thereon in relation to the partly paid-up equity shares of the Company.

Date: 13th April 2023

Place: Pune

For Suzion Energy Limited

Geetanjali S. Vaidya Company Secretary